

Renewables cheapest option to recover from Covid-19: IRENA

New Delhi: Renewable power is increasingly cheaper than any new electricity capacity based on fossil fuels...

lower power costs than the cheapest new coal plants. The report highlights that new renewable power generation projects now increasingly undercut existing coal-fired plants.

coal capacity could cost more to operate than the cost of new utility-scale solar PV, the report shows. Replacing the costliest 500 GW of coal with solar PV and onshore wind next year would cut power system costs by up to \$23 billion every year and reduce annual emissions by around 1.8 gigatons (GT) of carbon dioxide (CO2), equivalent to five per cent of total global CO2 emissions in 2019.

to around one per cent of global GDP. We have reached an important turning point in the energy transition. The case for new and much of the existing coal power generation is both environmentally and economically unjustifiable, said Francesco La Camera, Director-General of IRENA.

Enhancement of turnover limit of MSME sector to help exporters

New Delhi: The Government's decision to increase the turnover limit for medium units from Rs 100 crore to Rs 250 crore will help infuse technology and promote automation in certain sectors and boost outbound shipments, according to exporters.

Govt approves Rs 50K crore equity infusion for MSMEs

New Delhi: The Union Cabinet approved Rs 50,000 crore equity infusion for MSMEs to strengthen their growth potential. The government also approved Rs 20,000 crore subordinate debt for stressed MSMEs.

Jio platforms accounted for 85% of all PE/VC investments in May

New Delhi: The month of May recorded investments worth \$5.4 billion across 58 deals, with \$4.6 billion invested in Jio Platforms, according to the IVC-A-EY monthly PE roundup.

queue deals, Indian PE/VC investment activity is on a downward trajectory. Nonetheless, these deals help highlight investor confidence in the India story.

ume, deals in May 2020 declined 28 per cent y-o-y and 23 per cent sequentially (58 deals in May 2020 vs. 80 deals in May 2019 vs. 75 deals in April 2020).

Only 5% Asia Pacific infra firms highly exposed to Covid-19 disruptions: Moody's

New Delhi: Barely 5 per cent of the rated project and infrastructure companies in Asia Pacific have high exposure to coronavirus disruptions, Moody's Investor Service said.

dent and manager at Moody's. Airports now make up most of the high exposure category, he said. Whereas Moody's in April estimated 9 per cent of project and infrastructure companies had high exposure to coronavirus disruptions, this number has now declined to 5 per cent.

On the other hand, a small number of power utilities now have moderate exposure to coronavirus disruption, given rising pressure from falling power prices and lower demand, which is only partly offset by lower fuel costs.

VINYOFLEX LIMITED. Regd. Off : 307, Silver Chamber, Tagore Road, Rajkot - 360 002. CIN : L25200GJ1993PLC019830. Ph. : 0281-2468345, 2468776. Fax : 0281-2468839. Web site : www.vinyoflex.com. E mail : info@vinyoflex.com

NOTICE. Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) regulations, 2015 (Listing Regulations) Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on 25th June 2020, Thursday at 04.00 P.M. at the registered Office of the Company for taking on record of the audited Financial Results for the year/quarter ended on 31st March 2020.

NOTICE. M/s. Mansi Chemicals. Plot No.273/1/2, Phase-II, GIDC Vatva, Ahmedabad. It is to inform that Ms./ Mansi Chemicals, has been accorded Environmental Clearance by State Level Environment Impact Assessment Authority (SEIAA), Govt. of Gujarat vide its letter no: SEIAA/GUJ/EC/5(f)/699/2020 dated 9/06/2020 for its proposed expansion project for manufacturing of synthetic organic chemicals (5 to 33 MT/month) at Plot no.273/1/2, Phase-II, GIDC, Vatva, Ahmedabad.

SANBLUE CORPORATION LTD. Reg. off: 22-A, Government Servant Society, Near Municipal Market, C.G. Road, Ahmedabad-380009. Email : inquiry@sanbluecorporation.com • Website : www.sanbluecorporation.com. Sub: Intimation of Board meeting for the 4th Quarter & Year ended on 31st March, 2020

AHMEDABAD * MARKET * GUIDE

અંકુર સાથે ક્વૉલિટીનો વાયદો. સીઝનમાં ભરવા માટે અંકુર કપાસિયા તેલ. અંકુર કપાસિયા તેલ. Customer Care No: 079-22138250 www.ankurindustries.com

પથરીની સારવાર ઓપરેશન વગર. લીથોટ્રીપ્સી દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછા દરે પારંગત-પારદર્શક-વિશ્વસનીય સારવાર પરિમલ હોસ્પિટલ. પુનીતભાઈ, ઝઘડીયા ડિગ્રા પાસે, મહિનગર, અમદાવાદ-૯. Ph: 84600 65008, 98240 19394 (Estd.-1982)

An ISO 9001 Certified Co. HITECH Pumps. Mini monoblock. ડીઝલ એન્ટરપ્રાઇઝ. કડીયાકુર્જ, સીલીક રોડ, અમદાવાદ. ફોન : ૨૨૧૩૩૬૧૯, ૨૨૧૩૬૩૬૦

Patel Chem Specialities P. Ltd. A Consistent Quality / Innovative Solutions. A GMP & ISO 9001:2015 CERTIFIED COMPANY. Plot No. 272/4-5, Phase-II, GIDC Estate, Vatva, Ahmedabad - 382 445. Gujarat, INDIA, Phone : +91 79 2970 9854 / +91 97129 99854, E-mail: info@pcspl.net • Website : www.pcspl.net

સ્પે. કેસરના પેંડા કિલોમાં ૭૫ થી ૮૦ નંગ, ફ્રાયક્રટ, ફરાળી ચેવડો, ફરાળી વેફર્સ / કેળાની વેફર્સ, કાચુ કતરી, વિવિધ કાચુની મિઠાઈઓ, ફરાળી દુધનો હલવો. રચીદેસી. માણેકચોક, ફોન- ૨૨૧૪૦૦૫૪. સિવાવીક વાઘા, IIM રોડ, આંબાવાડી. ફોન- ૨૬૩૦૯૩૯૩. સ્ટેડીયમરોડ, નવરંગપુરા, ફોન- ૨૬૪૬૯૬૯૬. ચોર વેજીટેરીયન કેંક / પેસ્ટ્રી

PATEL EXPRESS COURIER. વ્યાજબી ભાવે વિદેશ પાર્સલ સેવા ઝડપી અને સલામતી સેવા. અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, લંડન, યુરોપ, આફ્રિકા, મીડીલીસ્ટ. ૭-૮-૯ મોતીલાલ સેન્ટર, સેલ્સ ઇન્ડીયા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬, ફોન નં. ૨૭૫૪૫૫૪૫/૨૭૫૪૦૧૩૩, મો.૯૮૨૫૨ ૫૬૭૧૭

ગુજરાત ગર્વમેન્ટ માન્ય LTC પ્રવાસો જુરાવાલા કુરીયર. સિમલા મનાલી ડેલહાઈસી. હરિદ્વાર આગ્રા મથુરા. ગોવા મહાબલેશ્વર લોનાવાલા. મહેશ્વર બેંગ્લોર હાંદી કો.કેનાલ. સત્ત: જ્યોતિર્લીંગા ઇ.ભારત-રામેશ્વર કન્ચાકુમારી તિરુપત્તી. નેપાળ કાઠમંડુ પોખરા બનારસ. જગન્નાથપુરી ચંપારણ્ય કોલકત્તા ગંગાસાગર. BY AIR / RAIL / BUS / INDIVIDUAL PACKAGE Kerala-Darjiling-Nainital. "દાઈટેક ડિલ્હીંગ", મ્યુઝીયમની સામે, દિવાલ બલ્કોનાઈ સ્ટુલની બાજુમાં, પાલડી, અમદાવાદ (M) ૯૩૭૫૭૭૩૩૩, ૯૨૨૬૭ ૫૫૯૦૯ નીડોલ (M) ૯૦૯૬૨૫૧૧૫, ૯૨૦૮૭૭૩૩૩, ગાંધીનગર (M) ૯૯૨૪૦ ૨૦૬૦

Manufacturer & Exporter of Pharmaceutical Excipients & Speciality Chemicals. Super Disintegrants: Disolwell®, Croscarmellose Sodium, IP, BP, EP, USP-NF. Blow Tab®, Sodium Starch Glycolate, IP, BP, EP, USP-NF. Swellcal®, Carboxymethylcellulose Calcium, (Calcium CMC) JP, BP, EP, USP-NF. Binders & Fillers: Hindcel®, Microcrystalline Cellulose IP, BP, USP-NF, Pregelatinized Starch IP, Potato & Maize Starch IP. Viscosity Modifier: Rheollose®, Sodium Carboxymethyl Cellulose IP, BP, EP, USP-NF. Lubricants: Magnesium Stearate. API Intermediates: Sodium Monochloro Acetate

Kala Niketan (BOMBAYWALA) Designer Sarees, Chaniya Choli, Salwar Kameez, Dress Materials. 'K.N. House', Nobles, Opp. Nehru Bridge, Ashram Road, A'bad-9. Tel. 26580050/51. BIG FESTIVE COLLECTION

મહેશ્વરી ટ્રેડિંગ (શુટીંગ - શર્ટીંગ - ટ્રેડીશનલ) (ગ્રે મેન્સ) અનલીમીટેડ સ્ટોક - લીમીટ લેસ વેરાઈટીઝ બધી જ વસ્તુ કાપડ + સિલાઈ સાથે. શુટ કમ્પલીટ ફક્ત ₹ 4999 માંજ કાપડ + સિલાઈ સાથે. ૩ પેન્ટ ફક્ત ₹ 5999 માંજ કાપડ + સિલાઈ સાથે. ૩ શર્ટ ફક્ત ₹ 2799 માંજ કાપડ + સિલાઈ સાથે. બ્લેઝર ફક્ત ₹ 2199 માંજ કાપડ + સિલાઈ સાથે. સેમીઈન્ડો/સેમીશરવાની ફક્ત ₹ 2999 માંજ કાપડ + સિલાઈ સાથે. કાપડ + સિલાઈ સાથે ફક્ત ₹ 1699 માંજ. વસ્તુઓના ભાવે, વસ્તુઓના ભાઈ બનાવે ને વસ્તુઓના પપ્પા પણ બનાવે સોનુ માનીતું સ્પે. દુલ્હા પેકેજ ફક્ત ₹ 7999 માંજ કાપડ + સિલાઈ સાથે. ભદ્રા, વાસલા પા, વર્ધમાન કોમ્પ્લેક્સ, ઓનેસ્ટની સામે, અંબલી ધ્રોવની નીચે, ભદ્રા ચાર રસ્તા, વાસલા, પાલડી, અમદાવાદ. નારણપુરા (સુંદરનગર) રવર, સુંદરનગર, મનીષ દેવેલી બાજુમાં, નારણપુરા ચાર રસ્તા થી કામેશ્વર મહાદેવ આપવાના રસ્તે, નારણપુરા, અમદાવાદ. Ph. : 079-26607614 SUNDAY OPEN (સવારે ૧૧.૩૦ થી ૮.૩૦) Parking Available Ph. : 079-66162109 SUNDAY OPEN (સવારે ૧૧.૩૦ થી ૮.૩૦) Parking Available